

--	--	--	--	--	--	--	--	--	--

Sl. No. : 502760

**001(G)**

(March, 2020)

**Time : 3 Hours]**

**[Maximum Marks : 100**

સૂચનાઓ :

- 1) આ પ્રશ્નપત્રમાં પાંચ વિભાગ (A, B, C, D, E) માં વહેંચાયેલું છે.
- 2) દરેક વિભાગના વીસ (20) ગુણ છે.
- 3) દરેક પ્રશ્નના અલગ-અલગ ગુણ છે. જમણી બાજુના અંક ગુણભાર દર્શાવે છે.
- 4) લેખન સજ્જતા - વિરામચિન્હો, જોડણી, ભાષાશુદ્ધિ, હાંસિયા તેમજ સ્વચ્છતા અંગે વિશેષ ધ્યાન આપવાનું રહેશે.
- 5) નવો વિભાગ નવા પાના પર લખવો.

### વિભાગ - A (પદ્ય આધારિત)

1. નીચેના પ્રશ્નોના માર્ગ્યા પ્રમાણે ઉત્તર લખો. (દરેકના 1 ગુણ) [4]

- 1) 'રામભાગ કૃતિનો કાવ્યપ્રકાર કયો છે? **૧૬-૩૧૩**
- 2) પ્રેમાનંદે આભ્યાનનું કથાવસ્તુ શામાંથી લીધું છે? **નાનાટ્ટેચાનગાંથી**
- 3) દ્વારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં છે? **૧૫૧મ રૂગી સાચીપે**
- 4) શામળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ જણાવો. **૧૫૧મ સાચી**

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. [4]

- 1) ગોપીઓ કયો નિયમ લે છે? **૧૨૧મ રૂગી સાચીપે (નાનુક) ના જીવાન**
- 2) દાદાએ પુત્રીને શી સલાહ આપી?

ઉત્તર : દાદાએ દીકરીને સાસરીમાં સુખ તો સૌ ભંગવે છે, પણ જે દુઃખ સહન કરે તે જ બાનદાન કહેવાય, એવી સલાહ આપી.

**3) ગામના સજ્જજનોએ શો ન્યાય કર્યો ?**

ઉત્તર : ડાલ્યાજનોએ ન્યાય તોણો, "આ કુલટાને પથર મારી, મારી નાખો!"— આ સાંભળી ઓલિયાના દિલમાં માનવતા જગી. આ ઓલિયાએ હંમેશાં પોતાની હસવાની ટેવ પ્રમાણે ત્યાં એકઘા થયેલા ડાલ્યાજનોને કહ્યું, "જોણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથર ફેંક." તેમના આ શબ્દોમાં અભયા નારી પ્રત્યેની માનવતા (ઇન્સાનિયત) દેખાય છે.

4) 'વૃક્ષની માફક ડાળ ફેલાવી જુઓ' એટલે શું ?

સૌ પવનની જેમ સહજ રીતે આવી ભળો છે; પરંતુ વૃક્ષની ડાળની જેમ કોઈને માટે છાપારૂપ તો બની જુઓ. [3 - 4]

3. નીચેના પ્રશ્નોના ચાર-પાંચ વાક્યમાં ઉત્તર લખો. (દરેકના 2 ગુણ)

1) 'વસ્તર વિનાની .... કેમ મો 'લાતુ' આ પંક્તિ પાછળનો કટાક્ષ સ્પષ્ટ કરો.

ઉત્તર : 'વસ્તર વિનાની ... કેમ મો 'લાતુ'?' આ પંક્તિ ગરીબની લાયારી પર સમાજનું ધ્યાન દોરે છે. એક બાજુ નિર્વલ્લ લીને પોતાની આબરૂ કેમ ઢાંકવી એ મૂળવણ છે, બીજુ બાજુ મહેલોમાં કે હવેલીઓમાં રહેતા લોકો પાસે પહેરવા એટલાં કપડાં છે કે એની આબરૂ આપોઆપ સચવાઈ જાય છે. સુખી માણસ જો સંવેદનદીલ ન હોય ને ગરીબને મદદ કરવાની સહાનુભૂતિ ધરાવતો ન હોય, તો એવા સુખી માણસોના મહેલો શા કામના? - એ કટાક્ષ આ પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે.

2) કવિ શબ્દરીને કેમ સંભારે છે ?

For More Papers Visit [VisionPapers.in](http://VisionPapers.in)  
Paper Credit: Youth Education

ઉત્તર : કવિ શબ્દરીને સંભારે છે, કારણ કે વખોથી શ્રીરામનાં દર્શન માટે જૂરતી શબ્દરી રોજ રોજ બોર વીણી લાવતી, તેને ચાખતી, જેથી શ્રીરામને ભોજનમાં ધરવાનું એક પણ બોર ખાટું ન નીકળે. શબ્દરીની વખોની તપશ્ચયા ફળી. શ્રીરામ તેની ઝુંપડીએ પધાર્યા, તેનાં એઠાં બોર આરોગ્યાં, શ્રીરામનાં દર્શનથી શબ્દરી ધન્ય થઈ ગઈ. જ્યારે વખોથી એકલતામાં સંતાનો માટે જૂરતી બાના જીવનમાં સુખદ ક્ષણ ક્યારેય આવી નહિ. શબ્દરીની વેદના કરતાં બાની વેદના વધુ છે એમ કવિ કહે છે.

#### 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. (દરેકના 4 ગુણા)

##### 1) ‘અધિલ બ્રહ્માંડમાં’ પદમાં નરસિંહ મહેતા પરમતત્ત્વને શી રીતે સમજાવે છે?

‘એના<sup>3</sup> પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો : (4 ગુણા)

\* (૧) ‘અધિલ બ્રહ્માંડમાં’ પદમાં નરસિંહ મહેતા પરમતત્ત્વને શી રીતે સમજાવે છે?

ઉત્તર : ‘અધિલ બ્રહ્માંડમાં’ પદમાં પરમતત્ત્વને સમજાવતાં નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રીહારિ જ સર્વવ્યાપી છે; પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે. કથી કહે છે કે ભૂધરા (હે કૃષ્ણ), તુ સર્વવ્યાપી છે. ક્રેમ કે, પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે. તું જ આકાશમાં વૃષ થઈને વિસરી રહ્યો છે. તેને આવી રસમય વિવિધ રૂપના કરી છે. એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. વેદ એમ કહે છે કે કનક અને હુંડળ એ બેમાં કોઈ ફરક નથી.

કનક(સોના)માંથી અનેક ધારના અલંકાર બનાવીએ, પણ એ ફરક ધારમાં સોનું જ હોય છે. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાચી પૂરે છે, પણ પરમાત્મા વિશે વાત કરતાં ગ્રંથોએ જરબર કરી છે, મુજબ વાત કરી નથી, પરિણામે જેને જે ગમે તેને જ પૂર્ણ છે. મતો-વચન અને ક્રમથી એને જ સત્ય માની લે છે. પરંતુ કથે નરસિંહ મહેતા કહે છે વૃક્ષમાં બીજ તું અને બીજામાં વૃક્ષ પણ તું છે. એ બેમાં બેદ છે છતાં એની બેદ રહિત સ્થિતિ અહીં રજૂ કરી છે. અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે, સત્ય (દ્વારીકાર) તો એ છે કે મનથી શોધ કરતાં સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા (પ્રેમથી) પ્રગટ થશે. પરમાત્માનો સાક્ષાત્ અનુભવ કેવળ પ્રેમભક્તિથી જ થઈ શકે છે.

‘ઉર્મિલા’ ખંડકાવ્યને આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો.

ઉત્તર : લક્ષ્મણ રામસીતાની સાથે તેમની સેવામાં વનવાસ જવા નીકળે છે. રાજસુખનો પરિત્યાગ કરી લક્ષ્મણ ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. ઉર્મિલા દૂરથી તેના વધાવાને ડેક વેગથી આપતા જુગે છે. લક્ષ્મણને આ વેશમાં જોઈને અને પતિના વિયોગનો વિચાર કરતાં તેનું ડેઝું ચિરાઈ જાય છે; પરંતુ ભાવિ સંકટે પર સંયમ કેળવી ઉર્મિલા પોતાના સ્વામી સન્મુખ ધીરજ ધારણ કરીને પ્રિયી રહે છે. આ વાસ્તવિકતાને પચાવવી મેટલી સહેતી નથી, પણ એક રાજવધૂ તરીકે તે પરિસ્થિતિને સ્વીકારે છે અને લક્ષ્મણને તેના સત્કાર્યમાં સાથ આપે છે. ઉર્મિલાના હૈપે પોતાના દ્વારાત્મસુખ કરતાં રાજકુદુલનું હિત વધારે વસ્યું છે. ધાર્યું હોત તો તે પતિ લક્ષ્મણને વનમાં જતાં રોકી શકી હોત. તે શા માટે વગર વાંકે રાજકુદુલમાં રહીને રામસીતા, લક્ષ્મણની જીમ ચૌદ વરસ વનવાસ વેઠ? નપણ લક્ષ્મણમાં જેટલો રાજધર્મ અને બંધુમેમ રહ્યો છે તો અથીએ ‘વિશેષ ધર્મકાર્ય પ્રત્યેની ઉત્કટ ભાવના ઉર્મિલામાં છે. હૈપામાં ભલે સર્પદશ જેટલી ચોટ લાગી હોય, પણ એ પરિવારધર્મથી વિચલિત થતી નથી. સાચા અર્થમાં તે ત્યાગની મૂર્તિ છે. ન્યાય-અન્યાયનો વિચાર કર્યા વગર સમર્પિતભાવે લક્ષ્મણને અના કાર્યમાં સાથ આપે છે. ઉર્મિલાની આ મનઃસ્થિતિને લક્ષ્મણ એક શૂરવીર યોગ્યા સાથે જરખાવે છે.

સંસ્કારી, સમજું, કર્તવ્યનિષ્ઠ, કુટુંબતસ્તલ, પોઢા જેવી શૂરુવીર, દ્વારાત્મસુખ પરલે ત્યાગનિષ્ઠ, પતિગ્રિયા અને રાજકન્યા તરીકે તથા રઘુવંશની કુળવધૂ તરીકે રાજયંશને દીપાવનારી ઉર્મિલાના વર્તન અને પાણી આગળ લક્ષ્મણ તો શું ભલભલા નતમસ્તક થઈ જાય એવી ઉમદા નારીનું આ ચરિત્ર કેવળ રઘુકુળનું જ નહિ, પણ ભારતવંશનું એક નાનાયણ, અણહજતું રલ છે. હદ્ય પર પછાર મૂર્તિને લક્ષ્મણને વિદાપ માયા પણી ઉર્મિલાની ધીરજનો ધોય છૂટી પડે છે અને લક્ષ્મણની પીઠ વળતાં જ ભલે તે ‘ધાર્ય’ કહીને મૂર્છા ખાઈને વણી પડી હોય, પણ આ મૂર્છા ઉર્મિલી નારી વાયકના ફટયને સ્પર્શી જાય છે,

**For More Papers Visit VisionPapers.in  
Paper Credit: Youth Education**

2) દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને ક્યા ક્યા વરદાન આપ્યા છે ?

ઉત્તર : દેવોએ પ્રસન્ન થઈને નળ અને દમયંતીને કુલ નવ વરદાન આપ્યા. દરેક દેવ બે-બે વરદાન આપ્યા. સૌપ્રથમ ઈન્દ્રસાયે નળને લાખો વર્ષ સુધી સુકાય નહિ એવી કમળમાળા આપી. ઉપરાંત એક અશ્વમંત્ર આપ્યો. એ મંત્ર ઘોડાના રાજમાં બોલતાં તરત અશ્વ એક દિવસમાં સૌ જોજન દોડી શકશે. અજિનએ વરદાન આપ્યું, 'તું અજિનથી દાખીશ નહિ અને તું જ્યારે મને યાદ કરીશ કે તરત જ હું પ્રગટ (હાજર) થઈશ.' ધર્મ વરદાન આપતાં કહ્યું, 'તું જ્યાં સુધી રાજ ભોગવીશ ત્યાં સુધી તારા રાજમાં કોઈને રોગ નહિ થાય અને તારી કથાનું જે વાચન કરશે તેને ક્યારેય જીવનું (માગવું) નહિ પડે.' અંતમાં વરુણે વરદાન આપતાં કહ્યું, 'તારા રાજમાં સર્વ વૃક્ષ નવપત્રલિત થઈ જશે અને તું મારું સ્મરણ કરીશ કે તરત જ તારા રાજમાં જળ વરસશે.' એ પછી દમયંતીને વર આપ્યો, 'તારા હાથ અમૃતસ્વિયા થણે એટલે તેના હાથમાં કોઈ પણ મૃત વસ્તુ મૂકવામાં આવશે તો તે તરત જીવંત થઈ જશે.'

'પથ્થર થરથર ધૂજે' કાવ્યનો સાર આપો.

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સાવિસર ઉત્તર લખો : /4 યુધ્ધા/

✓ (1) 'પથ્થર થરથર ધૂજે' કાવ્યનું શીર્ષક ચ્યાદો. (જેણે પાપ કર્યું ના એકે)

ઉત્તર : 'પથ્થર થરથર ધૂજે' શબ્દો સ્વૂચ્યદે છે કે ડાખા માણસોએ તોઝેલો ન્યાય સાંભળી પથ્થર દિલનો માણસ પણ ધૂજું ગઠે. જ્યારે અહીં તો એવા લોકોના હાથ પથ્થર મારવા માટે તરફી રહ્યા છે, જેમને ન્યાયનો અમલ કરવામાં જાડો આનંદ આવતો હોય! તેમનું આ વર્તન નિદ્દનીય છે. દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નથી કે જેણે જાણ્યે કે અજાહયે નાનું કે મોટું પાપ ન કર્યું હોય! એક પણ વ્યક્તિ સંપૂર્ણપણે

નિર્દોષ નથી, તો પછી દોષિત વ્યક્તિને આવો કૂર ચુકાદી કેવી રીતે આપી શકે? અને તે પણ હે કલેજે! કવિઓ આવા નિષ્ઠુર માણસની નિર્દ્યતાની અહીં નિંદા કરી છે. કવિએ કાવ્યના અંતે હિસુ પ્રિસનું વચન 'જેણે એક પણ પાપ કર્યું ન હોય તે જ પહેલો પથ્થર ફેંકો!' મૂકીને જાડો કહેવાતા ડાખાજનોને પોતાનાં કમો તરફ આયનો બતાવ્યો છે. આવો કૂર ન્યાય એ ન્યાય નથી, પણ માનવતા પર પ્રણાર છે. પથ્થર હૃદયના માણસને પણ ધૂજાવી હે તેવો છે. આ દાખિએ 'પથ્થર થરથર ધૂજે' શીર્ષક વધ્યાર્થ છે.

## વિભાગ - B (ગાંધી આધારિત)

5. નીચેના પ્રશ્નોના માણ્યા પ્રમાણો ઉત્તર લખો. (દરેકના 1 ગુણ) [4]
- 1) 'આંસુભીનો ઉજસ' પાઠના લેખકનું નામ લખો. હિન્દુ ૧૧૨૫
  - 2) 'મા'ત્માના માણસ' પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે કિંદ્રાના બનનાનાંથી.
  - 3) 'હેલ્દુ દર્શન' કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. વાનોં
  - 4) ઈવાદેવ કોનું ઉપનામ છે? પ્રદ્રસ્ત નંદશાસ્કર દ્વારા
6. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (દરેકના 1 ગુણ)
- 1) વિનોબા એ કયા કયા વ્રતોનું પાલન બરાબર કર્યું હતું?
- ખસ્યાદ્વાત, અપરિશ્રદ્ધત,  
સત્ય, અહિંસા-બ્રહ્મચર્ય જેવા વ્રતોનું પાલન કર્યું હતું.
- 2) અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્રહિત છે?
- ઉત્તર : અમરનાથ યાત્રામાં બરફના ઝુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્રહિત છે.
- 3) શેતકેતુના કુળમાં શો રિવાજ હતો?
- પદ્મોપાયિત લાદ્યા, પછી ઊડુનોંટોંકાદ  
 રિદ્યા, માનાપાંગો, રિવાજદાંગો.
- 4) ડૉ. બાબાસાહેબના જીવનની તત્ત્વત્રયી કઈ છે?
- ઉત્તર : સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એ ડૉ. બાબાસાહેબ આંગેડુરના જીવનની તત્ત્વત્રયી છે.

7. નીચેના પ્રશ્નોના ચાર-પાંચ વાક્યોમાં ઉત્તર લખો. (દરેકના 2 ગુણ) [4]

1) ઉછીનું માગનારની નજર કેવી હોય છે?

ઉત્તર : ઉછીનું માગનારની નજર ગીધ જેવી હોય છે. ગીધ જેમ તાજી મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે તેમ આડોશીપાડોગીના ધરમાં કોઈ નવી ચીજ આવે કે તરત તેના પર સૌથી પહેલી નજર તેમની પડે છે, કારણ કે તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને માટે જ આવી છે.

2) મહારાષ્ટ્રાએ કાશ્મીર આવવા પ્રભાશંકરને કેવી લાલચ આપી?

ઉત્તર : કશ્મીરના મહારાષ્ટ્રાએ પ્રભાશંકર પાસે એ પ્રસ્તાવ મૂક્યો, “ભાવનગર ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે. આપ કશ્મીરને પોતાનું કરો તો હું માસિક પાંચ દશારથી ઓછા નહિ આપું અને આપની યોગ્ય કદર કરીશ.” પ્રભાશંકરે એ પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં કહ્યું, “ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ મને આગળ આહ્યો. એ દેવ થયા ત્યારે તેનાં સંતાનો મને સૌંપત્તા ગયા છે. જે હું સત્તા કે ઘનને લોભે એ બધું ભૂલી, ફગાવીને આવું તો પછી હું આપને કે કશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ.”

8. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. (દરેકના 4 ગુણા)

[8]

1) 'યુધિષ્ઠિર યુદ્ધવિષાદ' નાટકના અંતની ચર્ચા કરો.

ઉત્તર : 'યુધિષ્ઠિર યુદ્ધવિષાદ' નાટકમાં અંતે સૌચે સમજાવ્યા છતાં યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી. તે મક્કમપણે નિર્ણય લે છે કે તે પ્રજાનો સેવક બનશે. તે ચાકર થઈને રહેશે, પણ સિંહસન ઉપરથી સેના / સત્તા નહિ કરે. બિખ્યુ થઈને રખડશે ને પોતાનાં પાપોનું ભાન પામશે. કેટકેટલાંએ પોતાનાં વલાલાં ગુમાવ્યાં છે, તેમના કરુણ વિલાપો પોતાના કાને સાંભળશે. પોતાને લીધે જ આજે પુત્રવિધોગમાં કેટલીય માતાઓ જૂરી ભરે છે. આટલું કહેતાં ભાવાવેશમાં આવતાં યુધિષ્ઠિર ફળી પડે છે. યુધિષ્ઠિરે યુદ્ધના વિષાદમાંથી લીધેલો નિર્ણય સાંભળીને ભીમ પોતાને દોષિત હરાવતાં કહે છે કે હું જ પાપી હતો. હું જ ઝેરનું પૂતળું હતો. અર્જુન કબૂલે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું! પાંચાલી પણ જંખવાણી થઈને કહે છે કે મારાં જ પાપનું આ પરિણામ છે. આમ, યુધિષ્ઠિરના શબ્દો સાંભળી તેઓ પ્રાયશ્ક્રિતત્ત્વે પોતાનો ગુનો કબૂલ કરે છે. અંતમાં શ્રીકૃષ્ણ પણ 'એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું ...' આટલા શબ્દો બોલીને પોતાની વાત છોડી હે છે. હું કિંતમાં યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે કે માણસના શરીરની સાથે લડવા કરતાં તેમનામાં રહેલી દુર્વૃત્તિ સાથે લડવાની જરૂર છે. શ્રીકૃષ્ણે અધૂરું મૂકેલું વાક્ય આ જ વાતનો સંદેશ આપે છે, પણ સાથે એમ પણ કહેવા માગતા હશે કે તમે ગમે તેટલા પ્રયત્ન કરો, પણ આવી દુર્વૃત્તિ ઘરાવતા અસુરો પોતાનો આ સ્વભાવ ક્યારેય છોડતા નથી. એ મર્મથી નાટકનો અંત આવે છે.

ખીજડિયે ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન દર્શાવો.

ઉત્તર : ભોજાએ પોતાનાં નાનાં બાળકો માટે કબરમાં ઘટેલાં બાળકોના અંગ ઉપરથી કપડાં ઉતારી લાવવાનો વિચાર કર્યો. રાતે સીમની અવરાજવર બંદ થઈ ગઈ હોય ત્યારે તેણે ત્યાં જઈ કબરને ખોડી. તેમાંથી દળવેકથી તેણે લૂગડે વીટયા બાળકને ખાડામાંથી ઊંચકૃષું, પણ એ અચેતન બાળકનો દેહ સહેજ સળવણ્ણો. આ જોઈ તેને થયું કે આ કોઈ ખવીસની રમત તો નહિ હોય! પણ વધુ વિચાર કરવાને બદલે તેણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં એ સ્થળ છોડી જવું જરૂરી છે, એમ તેને લાગ્યું. તેને ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો પણ એથી ધોર ખોદવાનો ઉદેશ માયો જાય અને અંગઢંકડા કપડાનું શું થાય? - આવા અનેક વિચાર તેને આવવા લાગ્યા. લૂગડું ઉતારી આ બાળકને પાછું હતું એમ દાટી દેવાના આ ભયંકર વિચારથી એ છૂંછ ગયો, તેણે વિચાર કર્યો કે આમ કરવાથી તો બાળકત્યાનું પાપ લાગે. આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું, અંતે તે વધારે વિચાર કર્યું વગર બાળકને લઈને સહસડાટ ટેકરો ઊતરી ગયો.

## 2) અનુરૂપનો ગૃહત્યાગ વાતાનો ધ્વનિ સ્પષ્ટ કરો.

ઉત્તર : 'અનુરૂપનો ગૃહત્યાગ' વાતા ભગવાન ગૌતમ બુદ્ધના પિત્રાઈ શાક્ય રાજકુમાર અનુરૂપની છે. સુખવૈભવમાં ઉછરેલા અનુરૂપે જીવનમાં 'નથી' એવો શબ્દ ક્યારેય સાંભળ્યો નહોતો. બિરંજ સુવર્ણના પાત્રમાં રંધાય છે અને તેમાં જ બને છે એવું બાલિશ અનુમાન કરનાર અનુરૂપ પ્રવજ્યા લે એ અકુલ્યનીય ઘટના છે. પ્રવજ્યા લેતાં પહેલાં તેને અનેક કસોટીમાંથી પસાર થવું પડે છે. એમાં એ સફળ થાય છે. તેમની સાથે તેમનો પરિચારક ઉપાલિ પણ આભૂષણોનો મોહ છોડી પ્રવજ્યા લેવા તેમની સાથે ચાલી નીકળ્યો. ઉપાલિની આ ત્યાગભાવનાને જોઈ સૌ રાજકુમારોએ ભગવાન બુદ્ધને ઉપાલિને સૌપ્રથમ દીક્ષા આપવાની વિનંતી કરી. તેની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજકુમારોની આ નિરભિમાની વૃત્તિથી તથાગતે પ્રસંન થઈ ઉપાલિને પ્રથમ દીક્ષા આપી. રાજકુમારોએ એ નવા ભિક્ષુને વંદન કર્યા, તેના શ્રમજ્ઞને યોગ્ય પરિચર્યા કરી ને પછી તેમણે પ્રવજ્યા લીધી. મક્કમ મનોબણ, દઢ શ્રદ્ધા, સંસારીજીવન મૃત્યે અનાસક્તિ, નિર્માણીપણું, નિરભિમાનીપણું, સમાતા જેવા ગુણો એ પ્રવજ્યા લેવા માટે અતિ મહત્વના છે. તે આ કથાનો મુખ્ય ધ્વનિ છે.

'શ્યામ રંગ સમીપે' નો આસ્વાદ કરાવો.

For More Papers Visit [VisionPapers.in](http://VisionPapers.in)  
Paper Credit: Youth Education

'શ્યામ રંગ સમીપે' પદમાં કવિ દ્યારાને ફૂલામય બનેલી ગોપીની ગ્રેમનક્ઝિતને વાચા આપી છે. ગોપી પણ ફૂલાથી નારાજ થઈ છે. આ પદમાં ફૂલા મૃત્યે રોષ પ્રગટ કરતી ગોપી જે-જે વસ્તુ કાળી હોય તે-તે દેરેક વસ્તુનો ત્યાગ કરવાનો સંકલ્પ કરે છે. એમાં શ્યામવર્ણ ફૂલાનો પણ સમાવેશ થઈ જાય છે; પરતુ ગોપીનું સન-

જાણે છે કે તેનો આ સંકલ્પ લાંબો સમય ટકવાનો નથી, કારણ કે તેનું મન ફૂલા મૃત્યેનો ગ્રેમ છોડવા શી રીતે રજી થાય? એટલે પદના અંતે ગોપીનું મન સ્વીકારી લે છે કે તેનો ફૂલા મૃત્યેનો રોષ લાંબો સમય નહિ ટકે. એનાથી તો તેનો સ્લેહભાવ જ વધવાનો છે.

Sl. No. : 502760

001(G)

(March, 2020)

Time : 3 Hours]

[Maximum Marks : 100

સૂચનાઓ :

- 1) આ પ્રશ્નપત્રમાં પાંચ વિભાગ (A, B, C, D, E) માં વહેંચાયેલું છે.
- 2) દરેક વિભાગના વીસ (20) ગુણ છે.
- 3) દરેક પ્રશ્નના અલગ-અલગ ગુણ છે. જમણી બાજુના અંક ગુણભાર દર્શાવે છે.
- 4) લેખન સજ્જતા - વિરામચિહ્નો, જોડણી, ભાષાશુદ્ધિ, હાંસિયા તેમજ સ્વચ્છતા અંગે વિશેષ ધ્યાન આપવાનું રહેશે.
- 5) નવો વિભાગ નવા પાના પર લખવો.

### વિભાગ - C

9. નીચેના શબ્દોને સમાનાર્�ી રૂપે સામસામે જોડી લખો. (કોઈપણ ચાર) (દરેકનો ½ ગુણ) [2]

- |           |   |        |   |        |
|-----------|---|--------|---|--------|
| 1) સમજ    | - | અલંકાર | - | મજા    |
| 2) બુદ્ધિ | - | નરમ    | - | પરોષણો |
| 3) કોમળ   | - | અતિથિ  | - | આભૂષણ  |
| 4) ઘરેણું | - | મતિ    | - | મૂઢુ   |
| 5) મહેમાન | - | અકલ    | - | ડાહાપણ |

10. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. (કોઈપણ ચાર) (દરેકનો ½ ગુણ)

- 1) એનું શરીર કાબૂમાં ન રહેતું. એનું શરીર લેકાનું રહેણું.
- 2) મિસ પંકજમ્ભનો હું મહેમાન હું. મિસ પંકજમણો હું વૃજભાગ નથી.
- 3) તે અતિમાની છે. તે નિરતિમાની વચ્ચે.
- 4) મને શરત મેજૂર છે. મને વારત ના મજૂર નથી.
- 5) મેનાબેન ઉત્સાહમાં આવી ગયા. મેના લટેને નિરૂત્તારી ન રહ્યું.

11. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. (કોઈપણ ચાર) (દરેકનો ½ ગુણા) [2]

- 1) પગનો ચાલવાનો અવાજ **ચાલાવણ**
- 2) ગોળ કે મહુડો ભેળવીને કેળવાયેલી તમારું. **તમારું**
- 3) જાંદું ટૂંકું ધોતિથું **ધોયાનું**
- 4) નીલા રંગનો મહિનો **માર્ગુંન માર્ગાની, વિલાન**
- 5) પીડા પામેલી વક્તિ **પીડાના**

12. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. (દરેકનો ½ ગુણા) [1]

- 1) ભરિયાં **ભર્યા**
- 2) હામ **હિંમત**

13. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. (દરેકનો ½ ગુણા) [1]

- 1) દિકરો દીધો **દીકરો**  
અથવા  
પ્રિતમ **પ્રીતમ** **પ્રીતમ**
- 2) પત્થરો પદ્ધાનું **પદ્ધાર** **પદ્ધાર**  
અથવા  
નીબંધ જનખંદ **નિબંધ**

14. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. (કોઈપણ છ) (દરેકનો ½ ગુણા)

[3]

- 1) બાકી સંચામાં તડ પુહેલેથી **જ** હશે. (વાક્યમાંથી નિપાત શોધો)
- 2) હરધનનું પથરાયેલું વિશ્વાળ મેદાન **પણ** રૂપ પલટો કરી બેહું હતું ! (ખોલી જગ્યામાં નિપાત લખો.)
- 3) **કાઠની પૂતળી** જેવી ઊભી સ્તબ્ધ બની રહી. (વાક્યમાંથી વિશેષજ્ઞ શોધો)
- 4) એના ..... સાથીદારોનો ટપકો પણ ખમતો. (ખાલીજગ્યામાં વિશેષજ્ઞ લખો.) **મૃદુભાષી**
- 5) પથ્થરો **બોલે** તો બોલાવી જુઓ. (વાક્યમાંથી કૃદંત શોધો)
- 6) પ્રભાશંકરે ..... તેને પૂછ્યું. (ખાલીજગ્યામાં યોગ્ય કૃદંત લખો)
- 7) બા મને **જોઈને** ખુશ થઈ જશે. (વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર જગ્યાવો)  
**ઝાંઝડુક લ્યાન્ડરન**

15. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેની વાક્યમાં પ્રયોગ કરો. (દરેકનો 1 ગુણ) [2]

1) ઉલાણધરાળ ન હોવું

### આગામ પાછળની ચિંતા ન હોવી

2) વધામણી આપવી

જુલૈ સમાઈએ ડેન્યુન.

16. નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. [3]

1) બા, એ બા ! કમાડ ખોલો હું છું હું ! (લેખનરૂઢિની દાખિએ સુધારો)

2) મારું હૈયુ કું વિચીત્ર ઉર્મિઓથી ધફધફ થઈ ઉઠ્યું. (ભાષા શુદ્ધિની દાખિએ વાક્ય સુધારો) આતું હૈયુ કું ટિંગિંગ ડાન્ફારોલ દ્વારા દ્વારા દ્વારા ઉઠ્યું.

3) શુદ્ધ ભેંસનું દુધ પીવું જોઈએ. (વાક્યનો પદક્રમ ગોઠવો)

ભેંસનું શુદ્ધ દુધ પીવું જોઈએ. અથવા

ડોશી~~અ~~ંતકાળ નજીક જાણી વૈદે તેમને કહ્યું. (વાક્યમાં પ્રત્યય સુધારો)

નો

17. નીચેના સંયુક્ત - સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવીને લખો. (કોઈપણ બે) (દરેકનો 1 ગુણ) [2]

1) તમે તમારે મજાથી રાજ કરો~~ને~~ મનની આશાઓ સંતોષો.

2) છેલ્લી કરીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે~~ત્યારે~~ જ કાવ્યમાં વક્તિ પ્રવેશો છે.

3) ભીમસેન ~~અને~~ તારામાં અઢળક બળ છે એ હું જાણું છું ~~પણ~~ તેથી મારી બુદ્ધિમાં શાંકા લાવવાનો તમને અધિકાર નથી.

18. નીચેના સાદા વાક્યોને સંયુક્ત - સંકુલ વાક્યોમાં ફેરવીને લખો. (કોઈપણ બે) (દરેકનો 1 ગુણ) [2]

1) મિત્રો કોઈ અવિનય લાગે. મિત્રો મને ક્ષમા કરજો.

2) અમ્માનો સમાચાર આપી~~એનો~~ અપ્પાને સમાચાર આપી~~એનો~~ એમનાા આશીર્વાદ લઈએ.

3) દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે. જન્મટીપની સજી માણસને ધીમે ધીમે ખતમ કરે છે.

તો

ત્યારે

## વિભાગ - D (અર્થગ્રહણ)

19. નીચેના પાઠચેતર પદ્ધના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં લખો.  
(દરેકનો 1 ગુણ)

[5]

છેલ્લું

સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં  
બારીનો કાચ ઊંચો કરી  
થાંભલા ગણ્યાં કરું છું  
એક પછી એક  
લેટફોર્મ આવતું જાય છે  
પણ એમાનું એકેય પરિચિત નથી  
મને ખબર છે  
છેલ્લું સ્ટેશન આવતા પહેલાં

YTG77 001(G)

Page 5

P.T.O.

નદી આવે છે.

લાલલીલી ઝંડીઓ ફરકે છે

પણ

રંગ ઓળખવાનું હું ભૂલી ગયો છું  
ને

ભૂલી ગયો છું છેલ્લા સ્ટેશનનું નામ..

પ્રશ્નો:

**For More Papers Visit VisionPapers.in  
Paper Credit: Youth Education**

- 1) કવિ શેની પ્રતીક્ષામાં છે? → દોસ્તી રહેણ માનવા
  - 2) છેલ્લું સ્ટેશન આવતા પહેલા શું આવે છે? → એકે પછી રાત્રે રજીસ્ટ્રોર્ન્સ
  - 3) છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ શું ભૂલી ગયા છે? → ઝડપી રીતે રજીસ્ટ્રોર્ન્સ
  - 4) પ્રતીક્ષાની કાચો કાચ તેવી રીતે મુસાર કરે છે? → રજીસ્ટ્રોર્ન્સ નાને રજીસ્ટ્રોર્ન્સ
  - 5) પરસ્પર કાચનું શીર્ફ આપો? → જાખીના કાચ ઊંચો કરી ચોલાના ઠાંઠાને ...
- ~ ~
- વાતાળો તાત્ત્વાનું (કાલાન રઘુ સાચા)

20. નીચેના પાઠ્યતર ગદ્યખંડને આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં લખો.

માણસ સ્વભાવથી જ કોઈકને પૂજતો હોય છે <sup>૧</sup> કેટલાક દેવ કરીને પૂજે છે, તો કેટલાક મનુષ્ય સમજતો છતાં પૂજે છે. જેને દેવ કરીને પૂજે છે, તેને પોતાની અલગ જાતિનો સમજે છે, જેને મનુષ્ય રાખી પૂજે છે, તેને પોતાનો ઓછોવતો આદર્શ કરીને પૂજે છે <sup>૨</sup> રામ, બુદ્ધ, મહાવીર, ઈસુ વગેરેને જુદીજુદી પ્રજાના લોકો દેવ બનાવી, માનવ કરી પૂજતા આવ્યા છે. એને આદર્શ કરી, એનો જેવા થવાની હોશ રાખી, પ્રયત્ન કરી પોતાનો અભ્યુદય સાધવો એમ નહિ, પણ એનું <sup>૩</sup> નામોચ્યારણ કરી એમાં ઉદ્ધારક શક્તિનાં આરોપણ કરી, તેમાં વિશ્વાસ મંડળી પોતાનો અભ્યુદય સાધવો એ આજની આપણી રીત છે <sup>૪</sup> એંધીતે ઓછીવતી પણ અંધશ્રદ્ધા એટલે બુદ્ધિ ન ચાલે ત્યાં સુધીની જ માત્ર શ્રદ્ધાની છે, વિચાર આગળ એ ટકી શક્તિ નથી.

પ્રશ્નો :

- 1) માણસ કયા કયા ભાવોથી વ્યક્તિની પૂજા કરે છે ?
- 2) મહાન પુરુષોને જુદી જુદી પ્રજાના લોકો કઈ રીતે પૂજતા આવ્યા છે ?
- 3) પૂજા પાછળની આપણી આજ સુધીની રીત કઈ છે ?
- 4) આ રીત અંગે લેખક શું માને છે ?
- 5) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. — ‘જીવન મુદ્દા’ — ‘બરી મુજા’

For More Papers Visit VisionPapers.in  
Paper Credit: Youth Education

YTG77. 001(G)

Page 6

21. નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી, તેને યોગ્ય શીર્ષક આપો.

આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈશું તો જ્ઞાશે કે એમને દુઃખ પહોંચાડવામાં કાંઈ જ બાકી નથી. ઈસુ, સોકેટીશ, નરસિંહ, મીરા, કબીર બધાને અનેક કસોટીઓમાંથી પસાર થવું પડ્યું હતું. નરસિંહ મહેતાને આખી જિંદગી ખાવાના સાંસા હતા. અને સમાજના મહેષાણ-ટોણા એઝો કેટલાં સાંભળ્યા છે ? પણ આજે ગુજરાતમાં એના ભજનો ઘેર ઘેર ભક્તિ ભાવથી ગવાય છે. સમાજ સેવકને મન આવી તાવણીમાંથી પસાર થવું હમેશાં સુખરૂપ જ હોય છે. આવા અનુભવથી તે ઘડાય છે, પાકો થાય છે તેના મન હદ્ય પુષ્ટ બને છે. એ ધ્યાન રાખવાની બાબત છે કે પ્રતિષ્ઠા કોઈથી આપી શકાતી નથી એ તો કર્તૃત્વાદ-ગુંગી સ્ત્રાત્મિક રીતે — પ્રજાનારી વસ્તુ છે.

શીર્ષક : ‘કર્તૃત્વાદ’

— સ્વામી વિવેકાનંદ

22. નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચારવિકાસના કમમાં ગોઠવી ફરીથી લખો.

તે અમારું નામલેણું રાખ્યુ. “અમારી ચામડીના પગરખાં સિવડાવીએ તોય તારા ગણનું સાદું વળે એમ નથી. ‘અમારે તો ઉંતરતી અવસ્થાએ દીકરાના નામની દશ્ય દેવાઈ ગઈ’ તી; તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે. મારા વીર ! પોસ્ટ માસ્તરના પત્ની બોલતાં હતા. છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું તું ;”

ઉત્તર : ‘અમારે તો આ ઉંતરતી અવસ્થાએ દીકરાના નામની દશ્ય દેવાઈ ગઈ’ તી ;’ પોસ્ટ-માસ્તરના પત્ની બોલતાં હતાં : “છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું તું. તે અમારું નામલેણું રાખ્યુ. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર ! અમારી ચામડીના પગરખાં સિવડાવીએ તો ય તારા ગણનું સાદું વળે એમ નથી.”

## વિભાગ - E (લેખન સજ્જતા)

23. તમારા નજીકના શહેરમાં આવેલ રંગ-રસાયણના કારખાનાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડી નદીને દૂષિત કરવામાં આવી રહી છે જે અંગે ઘટતી કાર્યવાહી કરવા તમારા જિલ્લાના કલેક્ટરશ્રીને અરજી કરો.

સાચા

પ્રેક્ષક : હૃષ્ણાલ પટેલ  
મુનિયાલી  
તા. જેસર, જિ. બાવનગર  
તા. ૨૮/૦૬/૨૦૧૯

પ્રતિ, આરોગ્ય મંત્રીશ્રી,  
ગુજરાત રાજ્ય, ગાંધીનગર.

વિષય :- રંગરસાયણના કારખાનાનું પ્રવાહી નદીના  
જળમાં ભણે છે તે બાબત.

આદરણીય શ્રી,

આમારું જેસર ગામથી આશરે દસેક ક્રિ. મી.  
દૂર એક રંગરસાયણનું કારખાનું આવેલું છે. જેની અંદરથી બગાડ યુક્ત કેમિકલ્સવાળો પ્રવાહી કર્યા આ કારખાનાની નજીકથી પસાર થતી નદીમાં ભણે છે. કારખાનાવાળાએ આ દૂષિત પ્રવાહીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરેલ નથી.

અમારા ગામના અસંખ્ય લોકો આ નદીના જળનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે. અને મૂંગા પણ અને પક્ષીઓ પણ આ પાણીનો ઉપયોગ કરે છે. પણ દૂષિત કેમિકલ્સ યુક્ત પાણી આ નદીમાં ભળવાથી લોકોને ચામડીના અસંખ્ય પ્રકારના રોગ થાય છે. અને કેટલાક માણસોની ચામડીમાં સખત બળતરા થાય છે. તો જાડા, ઉલટીના પણ મોટા ભાગના લોકો ભોગ બન્યા છે. અને પણ ઓને પણ કેટલીક બિમારીઓ જોવા મળી છે. આજુબાજુની વનસ્પતિ અને બેતાપેદાશની સંપત્તિ પર પણ આ દૂષિત જળ હાનિકર્તાં છે. વધારે પ્રમાણમાં આ રોગ વકરે નહિં માટે આપને આ અરજીથી ધ્યાન દોરીએ છીએ.

આ ગામના સર્વ નાગરીકો આશા રાખીએ છીએ કે આ અંગે ત્વરીત ઘટતી કાર્યવાહી કરશો.

સહકારની અપેક્ષા સહ....

For More Papers Visit VisionPapers.in  
Paper Credit: Youth Education

લી. આપનો વિશ્વાસુ  
હૃષ્ણાલ પટેલ  
સરપંચ - જેસર

## 24. નીચેના પાઠ્યોત્તર ગદ્યખંડનું વાવાત્મક ગદ્યમાં રૂપાંતર કરો.

ધન એ સુખ પ્રાપ્તિનું સાધન છે, પણ આજે એ સાધ્ય બની ગયું છે. એને કમાવા માટે ઉદાસીનતા ન દાખવવી અને વેડફવા ઉત્સુકતા ન દાખવવી પૈસો કદાચ તમારી સગવડમાં વધારો કરે, પણ સુખ તો સંતોષથી ભળશે. પૈસાને ઘિક્કારવાની જરૂર નથી. તેમ તેની કદમબોસી કરવાની જરૂર નથી.

અથવા

નીચેના પાઠ્યોત્તર ગદ્યખંડનું વાવાત્મક ગદ્યમાં લખો.

**દહેજ : સામાજિક કલંક વિશે ભાવાત્મક ગદ્યમાં લખો.**

શબ્દયાદી - દહેજ પ્રથા - સામાજિક રોગ - જ્ઞાતિ બંધનો - કરિયાવર - ચીજવસ્તુઓ ભેટ - આર્થિક તંગી - અસંહૃત ત્રાસ - નિર્દોષ યુવતીઓ - આત્મહત્યા - કરુણા અંજામ - જાગૃત સ્ત્રી સંસ્થાઓ - તિલાંજલી.

## 25. નીચેનામાંથી કોઈપણ એક વિષય પર આશારે 250 શબ્દોમાં નિબંધ લખો.

**પ્રકૃતિના સૌભ્ય - રૌદ્ર સ્વરૂપો :**

પ્રસ્તાવના - પ્રકૃતિના રભ્ય સ્વરૂપો : શરદ, વસંત, વર્ષા, પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપો : અતિવૃદ્ધિ, અનાવૃદ્ધિ, વાવાળોહું, ભૂકુંપ, સુનામી - ઉપસંહાર.

પ્રકૃતિમાં અપાર વૈવિધ્ય રહેલું છે. વસંત, શ્રીભૂ, વર્ષા, શરદ, હેમત અને શિરિરક્તુમાં પ્રકૃતિ જુદા જુદા શાણગાર સજે છે. તેમાં પ્રકૃતિના રભ્ય અને રૌદ્ર એમ બંને રૂપોનો આપણાને અનુભવ થાય છે.

શરદજાતુમાં કુદરત પ્રકૃત્યા વદને સ્થિત વેરે છે. જેતરોમાં રેલાતો સોનેરી રંગનો તરુણો અને હવાથી ડોલતી ફસલ રમણીય દેખાય છે. શરદપૂનમની શીતળ ચાંદની આપણાને પ્રકૃતિના રભ્ય સ્વરૂપનાં દર્શાન કરાવે છે. જુવાનિયાઓ દાંડિયારાસની રમણી રેલાવીને કુદરતના સૌંદર્યને માણો છે. વસંતજાતુમાં ખીલી ઊઠેલાં પુષ્પો અને ડાળીઓ ફૂટતી ઝૂપળો હારા કુદરતનું મનોહર સ્વરૂપ પ્રકટ થાય છે.

વષાંનુમાં કુદરતનું રમ્ય સ્વરૂપ ઉધાડ પામે છે. ખળખળ વહેતાં જરણાંનો કલકલ ધ્વનિ, ધરતી પર પથરાયેલું લીલુંછમ ધાસ, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, ક્યારેક આકાશને સપ્તરંગે રંગી દૃતું મેઘધનુષ, નયૂરોનું મનમોહક નૃત્ય, કોયલના ટહુકા વગેરેમાં પ્રકૃતિનો મનોહર ચહેરે જોવા મળે છે. રાતના અંધકારમાં ટમટમતા તારલા, જબૂક જબૂક થતા આગિયા અને આકાશગંગાની આભા પણ કુદરતના રમ્ય સ્વરૂપને પ્રગટ કરે છે. પ્રકૃતિના હાસ્ય વેરતાં આવાં રમણીય સ્વરૂપો આપણાને સ્વર્ગીય આનંદ આપે છે.

પ્રકૃતિનું એક સ્વરૂપ રમ્ય છે, તો બીજું રૌદ્ર સ્વરૂપ પણ છે. પ્રકૃતિ આપણાને ક્યારેક તેના રૌદ્ર સ્વરૂપનો પણ અનુભવ કરાવે છે. વષાંનુમાં ક્યારેક અતિવૃષ્ટિ થાય છે. પૂરનાં પાણી ગામો અને ખેતરોમાં ફરી વળે છે. પરિણામે જાનમાલનું ભારે નુકસાન થાય છે. ક્યારેક વષાંનું વરસ્યા વિના જ પસાર થઈ જાય છે, ત્યારે ખેતરો વેરાન ભાસે છે. પાણીની ભયંકર અછત સર્જય છે. અનાજ પાકતું નથી. કાળનોય કાળ એવો દુકાળ અનેક માનવીઓ અને પશુઓનો ભોગ લઈ લે છે.

**For More Papers Visit VisionPapers.in  
Paper Credit: Youth Education**

ક્યારેક કુદરત ભયંકર વાવાઝોડું ફુંકીને આપણાને તેની વિનાશલીલાનો પરચો બતાવે છે. વાવાઝોડા વખતે કુદરત તાંડવ નૃત્ય કરે છે. કેટલાંય તોતિંગ વૃક્ષો જડ-મૂળથી ઉખડીને ધરાશાયી થઈ જાય છે. દરિયાનાં મોળાં ઊંચે ઊછળે છે અને હોડીઓને દરિયાના પેટાળમાં

પદ્ધરાવી દે છે. કેટલાય મકાનો તેમજ ટેલિફોન અને વીજળીના થાંબલા જમીનદોસ્ત થઈ જાય છે.

ક્યારેક કુદરત ભૂકુપ કે જવાળામુખી વડે પોતાનું રૌદ્ર સ્વરૂપ દાખવે છે. ભૂકુપને લીધે નાનીમોટી કેટલીય ઈમારતો જમીનદોસ્ત થઈ જાય છે. ભારે માનવખુવારી થાય છે. રસ્તાઓ તૂટી જાય છે. જ્યાં જુણ હોય ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ હોય ત્યાં જુણ થઈ જાય છે. નદીઓનાં વહેણની દિશા સુદ્ધાં બદલાઈ જાય છે. આ બધી ઘટનાઓમાં આપણાને પ્રકૃતિનાં રૌદ્ર સ્વરૂપોનો અનુભવ થાય છે.

કુદરત તેનાં રમ્ય અને રૌદ્ર એમ બંને સ્વરૂપનાં દર્શન કરાવી આપણાને તેની અગાધ શક્તિનું અને આપણી અશક્તિનું ભાન કરાવે છે. કુદરત આગળ માનવીનું શાષ્ટ્રપણ હંમેશાં નિરર્થક પુરવાર થયું છે, તેથી જ કવિ કલાપીએ લખ્યું છે કે :

“જે પોષતું તે મારતું, શું એ નથી કમ કુદરતી?”

જનતા લોકશાહીનું સાચું બળ :

પ્રસ્તાવના - લોકશાહીના સંકલ્પનો અર્થ - પ્રજા અને જનતા - લોકશાહીનું સાચું બળ - જનતાની જવાબદારી - લોકશાહીની સફળતાના ચાર પાયા - ઉપસંહાર.

અથવા

પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન :

પ્રસ્તાવના - પ્રવાસના વિવિધ ફાયદા - પ્રત્યક્ષ જ્ઞાન - સૌંદર્ય દર્શિનો વિકાસ - સામુહિક જીવનનો અનુભવ - સાંસ્કૃતિક વૃત્તિનો વિકાસ - ઉપસંહાર.

જીવનમાં હંમેશા અનુભવનું મહત્વ અનેરું છે. અને અનુભવથી જ માણસ ઘડાય છે. જેથી એક સર્જિકું કહ્યું છે કે,

"જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ

અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી"

અનુભવ જીંદગીમાં મહત્વનો છે અને તે પ્રવાસથી વ્યક્તિમાં પાંગરે છે. વિશાળ વાચન, ઉંમન, સંતોનો સમાગમ વગેરે પરિબળો માનવીના જીવનઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે, પ્રવાસ પણ માનવીનું જીવન ઘડનાર એક મહત્વનું પરિબલ છે. કાકાસાહેબ કાલેલકરે ખરું જ કહ્યું છે, "જેમ કુંભાર માટીને ઘાટ આપે છે, તેમ પ્રવાસ પ્રવાસીને ઘડે છે."

પ્રકૃતિ, શિલ્પ - સ્થાપત્ય, સમાજજીવન વગેરે વિશે અનેક પુસ્તકો દ્વારા ન મળે એટલું જ્ઞાન એક પ્રવાસ દ્વારા મળી શકે છે. જેમ માતાને માટે કહેવાય છે કે "એક માતા સો શિક્ષકની ગરજ સારે", તેમ પ્રવાસને માટે કહી શકાય કે "એક પ્રવાસ સો પુસ્તકની ગરજ સારે ! " વાસ્તવમાં, પ્રવાસથી મળતું જ્ઞાન પુસ્તકિયા જ્ઞાન જેવું શુષ્ક નથી હોતું, અનુભવથી રસાયેલું હોય છે. એ જ્ઞાન માનવીના જીવનમાં કદી ન ભૂંસાય એ રીતે અંકિત થઈ જાય છે.

**For More Papers Visit VisionPapers.in  
Paper Credit: Youth Education**

પ્રકૃતિનાં સૌંદર્યધામોનો પ્રવાસ મનાવીનો જીવનને રસસભર બનાવે છે. અનુપમ પ્રાકૃતિક સૌંદર્યનું દર્શન આપણને ઊંડો, સાત્ત્વિક આનંદ આપે છે. ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ ઈતિહાસનાં પૂછોને આપણાં મનઃચ્યકુ સામે ખુલ્લાં કરી દે છે. પ્રતાપગઢનો કિલ્લો જોઈને શિવાળીની વીરતાની જે જીવંત ઝાંખી થાય, તે ઈતિહાસનાં પ્રકરણો વાંચવાથી ભાગ્યે જ થઈ શકે. એ જ રીતે, કલાવિવેચનનાં પુસ્તકો વાંચવાથી જે કલાસૂઝ ન વિકસે તે પ્રવાસથી માનવ વિકાસની અંદર નવું-નવું આણવાની જે જીવાસા વૃત્તિ પડેલી છે તે પણ સંતોષાય છે અને વ્યક્તિને કંઈક નવું જોવાનો આનંદનો અહેસાસ પણ થાય છે. આમ, પ્રવાસથી વ્યક્તિનો